

**Valuable Research Recommendations
on
Processing and Value Addition
(2004-2015)**



**Department of Processing and Food Engineering
College of Agricultural Engineering & Technology
Junagadh Agricultural University
Junagadh-362001**

December-2015

મૂલ્યવાન અનુસંધાનઅનુશંસાએંકિસાનો, પ્રોસેસરઔરપ્રોડ્યૂસર્સને લિએ
મૂલ્યવાનસંશોધનભલામણોઝેફ્ટો, પ્રોસેસર્સઅને ઉત્પાદકોમાટે
Valuable Research Recommendations for Farmers, Processors &
Producers

Year 2004

પ્યાજકાનિર્જલીકરણ
કુંગળીની સુક્વણી
Onion Dehydration

ઉદ્યમિયો/પ્યાજકાનિર્જલીકરણમે લગેઉદ્યોગકારોકોસિફારિશ કરતે હોય કે, પ્યાજ કી 3 મિમીમોટાઈ વાલી સ્લાઇસ કરકે, સુખાનેકેલિએ 76 ડિગ્રી સેલ્સિયસ તાપમાન ઔર 27 મીટર/પ્રતિ મિનિટ હવાકાવેગપરરખકે, કમસમય મેંઅચ્છી ગુણવત્તાવાનીનિર્જલિતપ્યાજ કે ગુચ્છેપ્રાપ્ત કરસકતે હોય



આથી કુંગળીના રીહાડ્રેશન કરતાં ઉદ્યોગ સાહસિકો / ઈન્ડસ્ટ્રીઝને ભલામણ કરવામાં આવે છે કે કુંગળીની ત મી. મી. ની પતરી (સ્લાઈસ) કરી 76 સેન્ટીગ્રેડ ઉષ્ણતામાને અને 27 મી/ મિનિટ હવાની જડપથી સુક્વણી કરવી જોઈએ. જેથી સારી ગુણવત્તાની સુક્વેલ કુંગળી ઓછા સુક્વણી સમયમાં મેળવી શકાય છે

The entrepreneurs / industry engaged in the dehydration of onion are recommended to dry the onion at 76 °C drying temperature and 27 m / min velocity of air keeping 3 mm thickness of onion slice to get good quality dehydrated onion flakes with lower drying time.

जीरासे सुगंधिततेल

જીરાનું સુગંધીત તેલ

Essential Oil from Cumin

ઉત્દ્યમિયો/પ્રસંસ્કરણ ઉદ્યોગકારોકોસિફારિશ કરતે હૈંકિ આસવનવિધિ કા ઉપયોગકરકેજીરાકેકણ મેં સે સુગંધિતતેલ(Essential oil) પ્રાપ્તકરને કે લિએ35 -48મેસ (0.417-0.295 મિમી)આકારવાલેજીરા પાઢર કા ઉપયોગ કરકે ઉચ્ચવસૂલીકે સાથ,અચ્છી ગુણવત્તા વાળા તેલપ્રાપ્ત કરસકતે હૈં



આથી ઉદ્યોગ સાહસિકો / પ્રોસીંગ ઉદ્યોગકારોને ભલામણ કરવામાં આવે છે કે નિષ્ઠંદન પ્રક્રિયા દ્વારા જીરામાંથી તેલ (એસેન્સીયલ ઓઈલ) કાઢવા માટે ઉપ થી ૪૮ મેસ (૦.૪૧૭ મીમી–૦.૨૮૫ મીમી) સાઈઝનો જીરાનો પાવડર ઉપયોગમાં લેવો જેથી સારી જાતનાં તેલની વધુ રીકવરી મળી શકે.

The entrepreneurs/Processing industries are recommended that the particle size of cumin should be between 35 - 48 mesh (0.417 mm– 0.295 mm) for extraction of good quality essential oil from cumin with higher recovery using water distillation method.

मिर्चसुखानेकीमशीन/ ड्रायर

भरचा सुकववानुं ड्रायर

Chillies dryer

किसानोंऔर उद्योगकारोको, लालमिर्चकोकृत्रिमविधिसे सुखाने केलिए, कृषिफसल के अवशेषोंकोजलाकरचलनेवालाविकसित ड्रायर का उपयोग करनेकीसलाहदीजाती हैं.इस ड्रायरद्वारालालमिर्चको 53 ± 20 C हवाका तापमान, 3.25मीटर/ सेकेंडहवाका वेगऔर10 सेमीमोटाई वालीतह के साथ सुखाने से अच्छी गुणवत्तावाले सूखे लाल मिर्चकम समयऔरकम लागतमेंप्राप्तकरसकते हैं



लाल भरचानुं वावेतर करतां जेझूतो अने उद्योगकारोने लाल भरचानी सुकवणी करवा युनिवर्सिटी द्वारा विकसावयेल कृषिजन्य उप-पेदाशो पर चालतां ऐश्रीकल्यरल वेस्ट फायर ड्रायर वापरवानी भलामण करवामां आवे छे. आ ड्रायरमां लाल भरचाने ५१ थी ५५ से. उष्णातामानवाणी हवा तथा ३.२५ मी./से. ना वेगे अने १० से.मी. जाहाईनां स्तरमां सुकवणी करवाथी सारी गुणवत्तावाणु सुकायेल लाल भरचु ओछा समयमां अने ओछी किंमते भेणवी शकाय छे.

The farmers and entrepreneurs are recommended to use the developed agricultural crop residue fired dryer for artificial drying of red chilies at 53 ± 20 C air temperatures with 3.25 m/s air velocity and 10 cm bed thickness to obtain good quality dried chilies with significant reduction in drying time and cost.

Year 2006

ધનિયાકે બીજકાભંડારણ

ધાણનો સંગ્રહ

Storage of coriander seeds

દક્ષિણસૌરાષ્ટ્રક્ષેત્ર કે કિસાનોં કે લિરસલાહદેતે હું કી અચ્છી તરહ સે સૂખેધનિયાકે બીજકા સંગ્રહકરને કે લિએ પ્લાસ્ટિકમેં લિપટેજૂટબૈગ(1:11:5.7,વૃદ્ધિશીલલાગત લાભઅનુપાત)યાઉચ્ચ ઘનત્વ વાળી(એચ્ડીપીઇ) 35માઇક્રોન-પૉલીથીન બૈગ મેં (વૃદ્ધિશીલલાગત લાભઅનુપાત1:7.23) કટાઈકે બાદ10મહીને તક સંગ્રહ/ભંડારણ કે લિયે, તમ્બાકુકે કીડે {સિગરેટબીટલ} (LasiodermaserricorneFeb.)કેપ્રકોપસે બચાયાજાસકતા હૈ.



દક્ષિણ સૌરાષ્ટ્રના ખેડૂતો માટે ભલામણ કરવામાં આવે છે કે ધાણને બરાબર સુકવ્યા બાદ અંદરનાંભાગમાં પ્લાસ્ટિકનાં આવરણવાળા શાણનાં કોથળા (ખર્ચ—આવકનો ગુણોત્તરશ—૧:૧૧.૫૭) અથવા ઉપમાઈક્રોન ઘટ વળાંટવાળી પોલીથીલીન (એચ્ડીપી.ઇ.) બૈગ (ખર્ચ—આવકનો ગુણોત્તર —૧:૭.૨૭)માંભરવાથી કાપણી બાદ ૧૦ માસ સુધી તમાકુનાં ભોટવા (સીગારેટ બીટલ) સામે રક્ષણ આપે છે

Farmers of south Saurashtra region are advised to store the Well dried coriander seed in plastic coated jute bag (ICBR1:11.57) or High Density Polyethylene (HDPE) bag 35 micron (ICBR1:7.23) to protect from the infestation of cigarette beetle (Lasiodermaserricorne Fab.) up to 10 months of storage after harvesting.


Year 2007

मूँगफली कामकर्खन.

ਮगफिनुं माखण।

Peanut Butter.

मूँगफली के मूल्य संवर्धनमें रुचिरखनेवालेकिसानों/उद्यमियोंको अच्छी गुणवत्तावाले मूँगफली का मक्खनके उत्पादन के लिए, मूँगफलीकीजी जी20 किस्मचयन करने की सलाहदीजाती हैं।



मगफिनी भूत्यवृद्धिमां रस धरावता उधोगकार/भेडूतोने सारी गुणवत्तावालु पीनट बटर (मगफिनुं माखण) बनाववा माटे जीजी-२० मगफिनी जात पसंद करवानी भलामण करवामां आवे छे।

The entrepreneurs / farmers interested in value addition in Groundnut / peanut is recommended to select the GG-20 cultivars of peanut for the production of good quality peanut butter.

जीराकलीनर-श्रेणी-निर्धारक/ग्रेडर

જીરાનું કલીનર – ગ્રેડર

Cumin cleaner cum grader

કૃષિપ્રોસેસ ઇંઝીનિયરિંગવિભાગ, કૃષિઅભિયાંત્રિકી વિશ્વવિદ્યાલય, જૂનાગઢવારા વિકસિતજીરાકલીનર- ઉપયોગકર્તાઓ કેલિએ સિફારિશ કી જાતી હોય.

એવંપ્રૌદ્યોગિકીમહાવિદ્યાલય, જૂનાગઢકૃષિ ગ્રેડર કીકિસાન, નિર્માતાઓંઔર અન્ય



એથીકલ્યરલ પ્રોસેસ એન્જીનિયરીગ વિભાગ, કૃષિ ઈજનેરી અને ટેકનોલોજી કોલેજ, જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી, જૂનાગઢ દ્વારાવિકસાવેલ જીરા માટેનું કલીનર કમ ગ્રેડર ખેડૂતો, મશીનરીના ઉત્પાદકો અને અન્ય વપરાશકર્તાઓ માટે ભલામણ કરવામાં આવે છે.

The cumin cleaner cum grader developed by Agricultural Process Engineering Department, College of Agricultural Engineering & Technology, Junagadh Agricultural University, Junagadh is recommended for the farmer, manufacturers and other users.

Year 2008

फल और सब्जी श्रेणी-निर्धारक / ग्रेडर

ફળ અને સાકારા નું ગ્રેડર

Fruits & Vegetable Grader

किसानों, प्रसंस्करण मशीनरी निर्माताओं और प्रोसेसर को चीकू, और समान आकार के अन्य फलों की ग्रेडिंग के लिए जूनागढ़ कृषि विश्वविद्यालय द्वारा विकसित हाथ से संचालित ग्रेडर उपयोग करने के लिए सिफारिश की जाती हैं।



આથી, ખેડૂતો, પ્રોસેસીંગ મશીનરીના ઉત્પાદકો અને પ્રોસેસીંગ કાર્ય સાથે સંકળાયેલા ઉદ્યોગ સાહસિકોને ગ્રેડિંગ કરવા માટે જૂ.કુ.યુ. દારા વિકસાવેલ હાથથી ચાલતાં ગ્રેડરનો ઉપયોગ કરવાની ભલામણ કરવામાં આવે છે।

The farmers, processing machineries manufacturers and processors are recommended to use hand-operated grader developed by Junagadh Agricultural University for grading sapota and other similar types of fruits on the basis of size.

Year 2009

મૂંગફલીબીજ કીગુણવત્તા.

મગફળીના બીજની ગુણવત્તા

Seed quality of groundnut.

દક્ષિણ સૌરાષ્ટ્રકૃતિ જલવાયુક્તેત્રકેકિસાનો કોસલાહ દી જાતી હૈકિ ગ્રીઝમક્રતુકી મૂંગફલી કી કટાઈકો છાયામેસુખાને કે બાદ, સંગ્રહકરને કે લિએ નમી 8.0--8.50 % (શુષ્ક આધાર), ફલી(4.86%) ઔરકર્નલ(4.92%) કે વજનમે ન્યૂનતમનુકસાન, ઉચ્ચઅંકુરણપ્રતિશત (81.04%), ન્યૂનતમ ફલી નુકસાન (10.66%) ઔરઉચ્ચ વૈધતા સૂચકાંક કોધ્યાન મેં રહેતે હુએ, જી-2તથા જી-7મૂંગફલીકીકિસ્મેકો 4માહકી અવધિ તક સંગ્રહકરનેકેલિએબેહતર હૈ.

ઇસીતરહ ખરીફ મૂંગફલી કી કટાઈકરછાયામેસુખાને કે બાદ સંગ્રહકરને કે લિએ નમી 8.0--8.50 % (શુષ્ક આધાર), ફલી(2.06%) ઔરકર્નલ(4.20%) કે વજનમે ન્યૂનતમનુકસાન, ઉચ્ચઅંકુરણપ્રતિશત (81.66 %), ન્યૂનતમ ફલી નુકસાન (9.22 %) ઔરઉચ્ચ વૈધતા સૂચકાંકકોધ્યાન મેં રહેતે હુએ, જી-2તથાજી-7મૂંગફલીકીકિસ્મેકો 6માહકી અવધિ તક સંગ્રહ કરનેકેલિએબેહતર હૈ.

સૌરાષ્ટ્રનાં ખેડૂતોને ભલામણ કરવામાં આવે છે કે, ઉનાણું મગફળીની કાપણી બાદ છાયામાં સુકવણી કરી રહી રહી રહી ૮.૫૦ ટકા ભેજે ચાર માસ માટે સંગ્રહ કરતા, દાઢા અને ડોડવાના વજનમાં સૌથી ઓછો ઘટાડો (૪.૬૨ અને ૪.૮૬ ટકા), વધારે ઉગાવાના ટકા (૮૧.૦૪ ટકા), ડોડવામાં થતું નુકસાન (૧૦.૬૬ ટકા) અને વધારે જુસ્સા આંક (૫૨૩.૫૭) ધ્યાનમાં લેતા મગફળી ની જીજી-૭ તથા જીજી-૨જાત સારી માલૂમ પડેલ છે.

તેજ રીતે ચોમાસુ મગફળીની કાપણી બાદ સુકવણી કરી રહી રહી ૮.૫૦ ટકા ભેજે છ માસ માટે સંગ્રહકરતા, દાઢા અને ડોડવાના વજનમાં સૌથી ઓછો ઘટાડો (૪.૨૦ અને ૨.૦૬ ટકા), વધારે ઉગાવાના ટકા (૮૧.૬૬ ટકા), ડોડવામાં થતું નુકસાન (૬.૨૨ ટકા) અને વધારે જુસ્સા આંક (૪૮૧.૮૦) ધ્યાનમાં લેતામગફળી ની જીજી-૭ તથા જીજી-૨જાત સારી માલૂમ પડેલ છે.

Farmers of south saurashtra agro climatic zone are advised that after shade drying of summer groundnut having about 8.0 to 8.50 per cent moisture content (wb) considering the minimum weight loss in pod (4.86%) and kernels (4.92%), higher germination percentage (81.04%), minimum pod damage(10.66%) and higher vigour index, the groundnut variety gg-7 followed by gg-2 found better for 4 month storage period.

Also in kharif groundnut having about 8.0 to 8.5% moister content (WB) considering the minimum weight loss in pod (2.06%) and kernels(4.28%), higher germination percentage(81.66%), minimum pod damage(9.22%) and higher vigour index, the groundnut variety GG-7 followed by GG-2 found better for 6 month storage period.

Year 2010

कम्बाइन हार्वेस्टर और थ्रेशर से गेहूंकी फसल की कटाई

કम्बाइन हार्वेस्टर से अनेथ्रेशर द्वारा धुंनी का पणी

Wheat obtained by combine harvester and thresher

किसान भाईओं को सलाह दी जाती है कि बीज उद्देश्य के लिए गेहूं उगाने, बेहतर अंकुरण और उच्च वैधता सूचकांक पाने के लिए स्वचालित कम्बाइन हार्वेस्टर की तुलना में थ्रेशर का उपयोग करें।



બીયારણ માટે ઘઉ ઉગાડતા ખેડુતોને ભલામણ કરવામા આવે છે કે, સ્વયંમ સંચાલીત કમ્બાઇન હાર્વેસ્ટર કરતા થ્રેસર વાપરવામા આવે તો ઘઉમાં અંકુરણ અને જુસ્સો વધારે સારા મળે છે।

Farmers growing wheat for seed purpose are advised to use thresher for better germination and vigour as compared with self propelled combine harvester.

सब्जियोंको सुखाने के लिए फसल अवशेष ड्रायर का उपयोग सुक्कवणी यंत्र द्वारा शाकभाजीनी सुक्कवणी

Drying of vegetables using crop residue dryer

नोकदार गाजरस्लाइस, गोभी के पत्ते, फूलगोभी के टुकड़े, टमाटरस्लाइस और हरी मिर्च को सुखाने के लिए जूनागढ़ कृषि विश्वविद्यालय द्वारा विकसित फसल अवशेषों पर आधारित मशीन (ड्रायर), का उपयोग करने के लिए निम्न आपरेटिंग मापदंडों का उपयोग करने के लिए एग्रोप्रोसेसर को, सिफारिश की जाती हैं।

1. हवा कातापमान: $51-55^{\circ}\text{C}$
2. हवा कावेग: 1.5 मीटर/ सेकेंड
3. तहकी (बेड) मोटाई: 8.0 सेमी
4. औसत ईंधन की आवश्यकता: 5.5 किलोग्राम / घंटा

शाकभाजीनी सुक्कवणी करता उधोग करो माटे जूनागढ़ कृषि युनिवर्सिटी द्वारा वीक्सावायेल ट्रूषिजन्य उप-प्रैदाशो पर चालता सुक्कवणी यंत्र द्वारा गाजरनुं छींश तथा पतरी, कोबीना पांडा, फ्लावरना टुकड़ा, टमेटानी पतरी अने आखा लीला भरचानी सुक्कवणी करवा माटे नीये जूऱावेल परिष्बणो राखवानी भलाभाष करवामां आवे छे।

1. सुक्कवती गरम हवानु तापमान : ५१ थी ५५ डिग्री सेलसीयस
2. सुक्कवती गरम हवानो वेग : १.५ मीटर प्रति सेकंड
3. सुक्कवणी स्तरनी जाहाई : ८ सेन्टीमीटर
4. बण्ठतानो जथ्थो : ५.५० कीलो ग्राम प्रति क्लाक

The agro processor interested in using the crop residue based dryer developed by Junagadh Agricultural University for drying serrated carrot, carrot slices, cabbage leaves, cauliflower pieces, tomato slices and whole green chillies are recommended to use following operating parameters :

1. Air temperature : 51 to 55 0C
2. Air velocity: 1.5 m/s
3. Bed thickness: 8.0 cm
4. Average fuel required: 5.5 kg/h

Year 2012

सब्जियों का निर्जलीकरण और भंडारण

शाकभाजुनिर्जलीकरण अथवा संग्रह

Dehydration and storage of vegetables

प्रोसेसर, निर्यातकोंको सलाह दी जाती है कि निर्जलित प्याज, लहसुन और कच्चा आम पाउडर के भंडारण को गुणवत्ता सभर बनाए रखने के लिये 50 μ (माइक्रोन) पॉलीथीन बैग (एचडीपीई) में, 740 मिमी पारा के निर्वात स्तर के साथ, वैक्यूम पैकेजिंग का उपयोग करके, 120 दिन तक की अवधि के लिए रखा जा सकता है।




Plate No. 3.6 Onion powder




Plate No. 3.7 Garlic powder



Mango Powder

प्रक्षियको अने निकास कारोने सलाह आपवामां आवे छे. के दुगाणी, लसाणा अने काची केरना पवडरने १२० दिवस संग्रह करवा माटे ५० माइक्रोन पॉलीथीलीन (एच.डी.पी.ई.) बैगमां वैक्यूम पैकेजिंग नो (७४० मीमी मरक्युरी) उपयोग करवो जोઈ अे।

The processors, exporters are advised to store dehydrated onion, garlic and unripe mango powder in polyethylene (HDPE) bags of 50 micron in vacuum packaging (740 mm Hg) to retain the quality up to 120 days of storage period.

પ્યાજકાભંડારણ

દુંગળીનોસંગ્રહ

Storage of onion

પરંપરાગત ભંડારણ સરચનામે પ્યાજસ્ટોર કરને વાલે કિસાનોએ ઔર વ્યાપારિઓએ કોસલાહ દી જાતી હૈ કી હવાદાર ભંડારણ સરચનામે પ્યાજકાભંડારણ (સ્ટોર) કરને સે ચાર મહીને કીઅવધિ કે બાદ બિક્રી યોગ્ય અધિક લાલ પ્યાજ બચાઈ જાસકતી હૈને.



ચાર મહીનાથી વધુ દુંગળીનો સંગ્રહ કરવા ઈચ્છુક ખેડુતો અને ટ્રેડર્સને ભલામણ કરવામાં આવે છે કે ફોર્સેડ એરવેન્ટીલેટેડ સ્ટોરેજ સ્ટ્રક્ચરને ઉપયોગ કરવાથી બજારમાં વેચી શકાય તેવી લાલ દુંગળી ઉંડ ટકા વધુ મળી શકે છે.

Farmers and traders who are interested to store the onion for more than four months are recommended to use forced air ventilated storage structure to get 36 % of more marketable red onion.

Year 2014

ताजा और प्रसंस्कृत अमरुद फल की पैकेजिंग

ताजाअनेप्रोसेसडजामक्षणुं पेकेजींग।

Packaging of fresh & processed guava fruits

किसानों, प्रोसेसर और निर्यातकों को अमरुद के लिए जूकृयु (जेरेयू) द्वारा विकसित निम्न मानकीकरण प्रसंस्करण की तकनीक अपनाने के लिए निम्नलिखित अनुमोदन किया जाता है.

अमरुद के फल को 50 μ पॉलीथीन बैग में 700 मिमी पारा के निर्वात स्तर के साथ पैकिंग करके कमरे के तापमान पर 18 दिनों तक अच्छी / ठीकतर हसेसंग्रह किया जासकता हैं / स्वजीवन में वृद्धि की जासकती हैं.



PRETREATED GUAVA SLICES LOADED IN TRAYS BEFORE DRYING.



LOADING OF DRYING TRAYS IN THE DRYING CHAMBER.



VACUUM PACKED GUAVA POWDER AFTER 80 DAYS OF STORAGE PERIOD.

ताजा अमरुद से अमरुद पाउडर के निर्माण के लिए 3 मिमी मोटी स्लाइस को 1% $\text{CaCl}_2 + 2\%$ KMS घोल में डुब्बा के 10 मिनट के लिए, 60°C तापमान और 1.25 मीटर/सेकेंड हवा के वेग से 17 घंटे की अवधि में सूखा याजासकता है.

अमरुद पाउडर को 50 μ पॉलीथीन बैग में 700 मिमी पारा के एक निर्वात स्तर के साथ पैकिंग करके कमरे के तापमान पर 80 दिनों के लिए अच्छी / ठीकतर हसेसंग्रह किया जासकता हैं / स्वजीवन में वृद्धि की जासकती हैं.

आथी भेड़तो, प्रोसेसरो अने निकास कारोने जामक्षण माटे जू.कृ.यु. द्वारा विकसाववामां आवेल स्टान्डर्ड प्रक्षियानी टेक्नीकनी नीये मुजबनी भलामण करवामां आवे छे.

जामक्षण ने 40 माइक्रोन पोलीईथीलीन बेगमा तथा 700 मीमी एच.जी. वेक्युम इभाषे संचाह करवानी आ रीते जामक्षण ने 18 दिवस सुधी सारी रीते संग्रही शकाय छे.

जामक्षण नी उ मीमी जाडाई पतरीने 1 % क्रेलिशयम क्लोरोराईड अने 2 % पोटेशीयम भेटा बायसल्फाईटना द्रावणमा 10 मीनीट डुब्बाडीने 60 °C उष्णतामानवाणी अने 1.25 मी/से. वेगवाणी हवा द्वारा सुकववानी भलामण करवामा आवे छे. आ रीते जामक्षण नी पतरीओनी सुकवणी करता 17 कलाक जेटलो समय लागे छे.

જામફળના પાવડરને ૫૦ માઈક્રોન પોલીઇથીલીન બેગમા તથા ૭૦૦ મીમી એચ.જી. વેક્યુમ દબાણે સંગ્રહ કરવાની ભલામણ કરવામાં આવે છે. આ રીતે જામફળના પાવડરને ૮૦ દિવસ સુધી સારી રીતે સંગ્રહી શકાય છે.

The farmers, processors and exporters are recommended to adopt packaging technique developed by Junagadh Agricultural University for increasing the shelf life of guava fruit up to 18 days at room temperature by packing in 50 μ polyethylene bag with a vacuum level of 700 mm Hg.

ભલામણઃ— ૧

આથી ખેડુતો, પ્રોસેસરો અને નિકાલકારોને જામફળની સંગ્રહક્ષમતા વધારવા માટે જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી દ્વારા વિકસાવવામાં આવેલ પેબેજીંગ ટેકનીક મુજબ જામફળને ૫૦ માઈક્રોન પોલીઇથીલીન બેગમા તથા ૭૦૦ મીમી એચ.જી. વેક્યુમ દબાણે સંગ્રહ કરવાની ભલામણ કરવામાં આવે છે. આ રીતે જામફળને ૧૮ દિવસ સુધી રૂમ તાપમાને સારી રીતે સંગ્રહી શકાય છે.

The farmers, processors and exporters are recommended to adopt hot air drying technique developed by Junagadh Agricultural University for preparing of Guava powder by drying of fresh guava slices (3 mm thick) pretreated with 1 % CaCl₂ + 2 % KMS solution for 10 minutes at 60°C drying air temperature and 1.25 m/s air velocity in drying period of 17 hours. The powder prepared by this method can be stored up-to 80 days at room temperature by packing in 50 μ polyethylene bag with a vacuum level of 700 mm Hg.

ભલામણઃ— ૨

આથી ખેડુતો, પ્રોસેસરો અને નિકાલકારોને જામફળનો પાવડર બનાવવા માટે જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી દ્વારા વિકસાવવામાં આવેલ ગરમ હવાથી સુકવણીની ટેકનીક મુજબ જામફળની ઉ મીમી જાડાઈ પતરીને ૧% કેલિશાયમ કલોરાઈડ અને ૨ % પોટેશીયમ મેટા બાયસલ્ફાઈટના દ્રાવણમાં ૧૦ મીનીટ ડુબાડીને ૫૦ સે. ઉષ્ણતામાનવાળી અને ૧.૨૫ મી/સે. વેગવાળી હવા દ્વારા સુકવવાની ભલામણ કરવામાં આવે છે. આ રીતે જામફળની પતરીઓની સુકવણી કરતા ૧૭ કલાક જેટલો સમય લાગે છે. આ રીતે સુકવેલ જામફળના પાવડરને ૫૦ માઈક્રોન પોલીઇથીલીન બેગમા તથા ૭૦૦ મીમી એચ.જી. વેક્યુમ દબાણે ૮૦ દિવસ સુધી રૂમ તાપમાને સારી રીતે સંગ્રહ શકાય છે.

फलपाउडर



सीताफलनोपावडर

Custard apple powder

किसानों, प्रोसेसर और निर्यातकों को जूकूयु (जे ऐ यू) द्वारा विकसित सीताफल को फ्रीज ड्रायर में रखकर सुखाने और भंडारण के लिए निम्नलिखित तकनीकों को अपनाने की सिफारिश की जाती हैं।

ताजे सीताफल के गूदों को 5% Maltodextrine के साथ मिश्रित करके -40°C के तापमान पर फ्रीज ड्रायर का उपयोग करके 41 घंटे की अवधि में सीताफल कापाउडर बना सकते हैं। इस विधि द्वारा प्राप्त सीताफल पाउडर बेहतर गुणवत्ता वाला होगा।

सीताफल पाउडर को ठीक/अच्छी तरह सेसंग्रहित करने के लिए/स्वजीवन में वृद्धि करने के लिए सीताफल पाउडर को 50 μ पॉलीथीन बैग में, 700 मिमी पाराकेनिर्वात स्तर के साथ पैकिंग करके 90 दिनों तक कमरे के तापमान पर अच्छी तरह से रखा जा सकता है।



3.4 FREEZE DRIED CUSTARD APPLE POWDER



6.3 CUSTARD APPLE POWDER WITH VACUUM
ON 90TH DAY OF STORAGE
(PREPARED AT - 40° C TEMPERATURE)

आधी खेड़तो, प्रोसेसरों अने निकास कारोने सीताफलना फ्रिज ड्राईंग तथा पावडरना संग्रह माटे जू. कू. यू. द्वारा विकसाववामां आवेल टेक्नीकनी नीये मुजबनी भलामण करवामां आवे छे।

सीताफलना पद्धने 5 % माल्टोडेक्स्ट्रीननी भावजत आप्या बाद -40 °से. उष्णतामाने फ्रिज ड्रायरमां सुकववाथी भलामण करवामा आवे छे। आ रीते सीताफलना पद्धनी सुकवणी करता ४१ क्लाक जेटलो समय लागे अने तेनी गुणवत्ता जणवाई रहे छे।

सीताफलना पावडरने ५० माईक्रोन पोलीईथीलीन बेगमा तथा ७०० भीभी एच.जी. वेक्युम दबाषे संग्रह करवानी भलामण करवामां आवे छे। आ रीते सीताफलना पावडरने ८० दिवस सुधी सारी रीते संग्रही शकाय छे।

The farmers, processors and exporters are recommended to adopt freeze drying TECHNIQUE and storage techniques for custard apple developed by JAU

For making of custard apple powder by freeze drying of fresh custard apple pulp pretreated with 5 % maltodextrine at -400 C temperature using freeze dryer in drying period of 41 hours. The custard apple powder obtained by this method gets better retention vitamins and carbohydrates.

For increasing the shelf life of custard apple powder up to 90 days at room temperature by packing in 50 μ polyethylene bag with a vacuum level of 700 mm Hg.

આથી ખેડુતો, પ્રોસેસરો અને નિકાલકારોને સીતાફળનો પાવડર બનાવવા માટે જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી દ્વારા વિકસાવવામાં આવેલ સુકવણીની ટેકનીક મુજબ સીતાફળના પદ્ધત (1.5 કિલો) ને 5% માલ્ટોડ્યુક્ટ્રીનની માવજત આપ્યા બાદ-૪૦ સે. ઉષ્ણતામાને ફીજ દ્રાપરમાં સુકવવાની ભલામણ કરવામાં આવે છે. આ રીતે સીતાફળના પદ્ધતની સુકવણી કરતા ૪૧ કલાક જેટલો સમય લાગે અને તેની ગુણવત્તા જાણવાઈ રહે છે. આ રીતે સુકવેલ સીતાફળના પાવડરને ૫૦ માઈક્રોન પોલોઈથીલીન બેગમા તથા ૭૦૦ મીમી એચ.જી. વેક્યુમ ડબાણે સંગ્રહ કરવાની ભલામણ કરવામાં આવે છે. આ રીતેસીતાફળના પાવડરને ૮૦ દિવસ સુધી સારી રીતે સંગ્રહી શકાય છે.


The farmers, processors and exporters are recommended to adopt freeze drying technique developed by Junagadh Agricultural University for preparing of Custard Apple guava powder by freeze drying of fresh Custard Apple pulp (1.5 kg) pretreated with 5 % Maltodextrineat 60^o C air temperature with a drying period of 41 hours. The Custard Apple powder obtained by this method has better product quality and could be stored upto 90 days at room temperature when packed in 50 μ polyethylene bag at a vacuum level of 700 mm Hg.

આલૂછિલકેસેએંજાઇમોંકી નિકાસી

બટાકાની છાલમાંથીઉત્સેચકો મેળવવા/કાઢવા

Extraction of enzymes from potato peels

આલૂ કા પ્રસંસ્કરણ કરનેવાલે ઉદ્યોગકારોકોઅનુમોદનકરતે હેંકિ,આલૂ કે છિલકે સેઅધિકલાભપ્રાપ્ત કરને કે લિએ,જૂનાગઢકૃષિ વિશવિદ્યાલયદ્વારા વિકસિત,આલૂકે છિલકે(પ્રતિફલ) સેસૂક્ષ્મ જૈવિકઔરજૈવ રાસાયનિકવિધિસેઅલ્ફા Amylaseઔર Proteaseએંજાઇમોંકેઉત્પાદન કે લિએબેસિલસ Subtilisબૈક્ટીરિયા કાઉપયોગકરકે, ઇસ પ્રક્રિયાકો અપનાને કીસલાહ દીજાતી હૈ.યહબાજારમેંઉપલબ્ધ તૈયારએંજાઇમોંકી તુલના મેં:૧:૭.૫૪વૃદ્ધિશીલલાગત લાભઅનુપાત(સીબીઆર),ફાયદેમંદ હૈ.



Potato peels as a waste of processing Crude Enzyme Extract

આથી બટાકાનું પ્રોસેસીંગ કરતા ઉધોગ સાહસીકો માટે ભલામણ કરવામાં આવે છે કે, જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી દ્વારા વિકસાવેલ પદ્ધતિ કે જેમાં બેસીલસ સબટીલીસ પ્રકારના બેકટેરીયાના ઉપયોગ દ્વારા બટાકાની છાલમાંથી સુક્ષમ જૈવિક તેમજ જૈવ-રાસાયણીક પદ્ધતિ દ્વારા આદફા એમાઈલેઝ તેમજ પ્રોટીઅેઝ નામના ઉત્સેચકો મેળવી વધુ લાભ લઈ શકાય છે. તેમજ તે બજારમાં તેથાર મળતાં ઉત્સેચકો કરતાં લાભકારક છે (ખર્ચ-આવકનો ગુણોત્તર ૧: ૭.૫૪ મળેલ છે).


To get more benefit, Potato processors are advised to adopt a procedure of use Bacillus subtilis bacteria for the production of Alpha-amylase and Protease enzymes through microbial and biochemical method from potato peels (byproduct) developed by Junagadh Agricultural University. It is beneficial (CBR 1:7.54) as compared to readymade available enzymes in market.

ચીકૂકલીનર

ચીકુકલીનર

Sapota Cleaner

કિસાનોં કો અનુમોદનકિયાજાતાહેંકિ, ચીકૂ કી કટાઈકે બાદ ચીકૂકલીનર કાંઈક સફાઈ અને ચમકદાર બનાને કેલિએ જૂનાગઢ કૃષિ વિશ્વવિદ્યાલય દ્વારા વિકસિત હાથ સે સંચાલિત ચીકૂકલીનર કા ઉપયોગ કરે.



આથી ખેડુતોને ચીકુ ને જાડ પરથી ઉતાર્યા બાદ ચીકુની સપાટીને સાફ અને ચળકતી કરવા માટે જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી દ્વારા વિકસાવાયેલ હાથથી ચાલતા કલીનરનો ઉપયોગ કરવાની ભલામણ કરવામાં આવે છે.

The farmers are recommended to use hand-operated sapota cleaner developed by Junagadh Agricultural University for cleaning and shining sapota surface after harvesting.

Year 2015

Extraction of pectin from Kesar mango peel by resins



Waste from Mango canning Plant




Pectin powder

आम का प्रसंस्करण करनेवाले उत्पादक को अनुमोदन करते हैं कि जूनागढ़ कृषि विश्वविद्यालय द्वारा विकसित, आम के छिलके से पेकिटन निकालने की प्रौद्योगिकी प्रक्रिया के रूप में, छिल के साथ कट-ऑफ़ -रेज़ीन को निष्कर्षण माध्यम में रखके, अधिकलाभप्राप्त करने के लिए, छिल के ऑर्गेनिष्कर्षण माध्यम के रूप में 1:4 के अनुपात, pH 2.56, और 80 डिग्री सेल्सियस तापमान में 60 मिनट की समय अवधी परदो बार एक्सट्रैक्शन सेबेहतर उपज और बेहतर गुणवत्ता वाला पेकिटन मील सकता है। इस विधि से पेकिटन की अधीक्तुपज के साथ (बीसीआर) लाभ-लागत अनुपात 1.17 की गुणवत्ता मील सकती है।

Mango processors are recommended to adopt a process technology developed by Junagadh Agricultural University for the production/extraction of pectin from mango peel using cation exchange resin as an extraction medium with peel to extraction medium ratio of 1:4, extraction pH of 2.56, extraction temperature of 80 °C, extraction time of 60 min and two times extractions. This method can give better yield and quality of pectin with benefit cost ratio (BCR) of 1.17.

કેરીનું પ્રોસેસીંગ કરતા પ્રોસેસરોને કેરીની છાલમાંથી પેકટીન મેળવવા માટે જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી દ્વારા વિકસાવવામાં આવેલ પદ્ધતિથી, કેટાયન એક્સચેન્જ રેજીનનો નિષ્કર્ષણ/એક્સ્ટ્રોક્શન માધ્યમ તરીકે ઉપયોગ કરી, છાલ તથા નિષ્કર્ષણ માધ્યમનું પ્રમાણ 1:4, pH. 2.56 અને નિષ્કર્ષણ પ્રક્રિયા દરમિયાનનું તાપમાન 80 °C સે જાળવી 60 મિનિટ સુધી બે વખત આ પ્રક્રિયા કરવાની ભલામણ કરવામાં આવે છે. આ પદ્ધતિથી સારી ગુણવત્તા ધરાવતા પેકટીનનું વધું ઉત્પાદન મેળવી શકાય છે. જેમાં લાભ અને ખર્ચનો ગુણોત્તર 1.17 મળે છે.

Storage study of mechanically damage wheat harvested by combine harvester



गेहूं को संग्रहित करने वाले किसानों को सलाह दी जाती है कि कमबायन हार्वेस्टर द्वारा यांत्रिक रूप से फसल काटने की मशीन से काटे हुये गेहूं को संग्रहित करने के लिए अनुपचारित गेहूं की तुलना में, बीना जूट बैग रखे, अरंडी का तेल (15ml / 1.0Kg अनाज) के उपचार के साथ गेहूं को संग्रहीत करने के लिए धातु कि कोठरी रखा जा सकता है, , यह कीट की जनसंख्या, अन्न की क्षति, और वजन घटाने को कम करता है और संग्रहण के आठ महीने के लिए कम अन्न बोरर के खिलाफ सुरक्षित रख सकते हैं।

The farmers storing wheat are advised that the mechanically damaged wheat harvested by combine harvester to be stored with the treatment of castor oil (15ml/1.0Kg grain) and can be kept in metal bin container to keep safe against lesser grain borer up to eight month of storage as it reduces pest population, grain damage, and weight loss as compared to untreated wheat kept in jute bags.

ઘઉ સંગ્રહ કરતા ખેડુતોને ભલામણ કરવામાં આવે છેકે કમબાઈન હાર્વેસ્ટર દ્વારા કાપણી કરી તૈયાર થતા ઘઉને કોઈપણ જાતની માવજત વિના શાશના કોથળામાં સંગ્રહ કરવાના બદલે ઓરડીયાની (૧૫મીલી/૧ કિલોદાણા) માવજત આપી લોખડની ટાંકી (મેટલ બીન) માં સંગ્રહ કરવામાં આવે તો સંગ્રહ દરમ્યાન આવતી જીવાત આંધળા જીવડા, તેનાથી થતું દાણાનું નુકશાન અને વજનમાં થતો ઘટાડો ઓછો જોવા મળે છે અને ૮માસ સુધી સંગ્રહ કરી શકાય છે.

फॉरफर्डरइन्फर्मेशनप्लीज़कॉट्कट:

For further information please contact to:

प्रोफेसरअण्डहेड

डिपार्टमेंटप्रोसेसिंगअण्डफुडइंजिनियरिंग

कॉलेजऑफआग्रिकल्चरलइंजिनियरिंगअण्डटेक्नालजी

जूनागढ़आग्रिकल्चरलयूनिवर्सिटी

जूनागढ़-362001

Professor & Head

Department Processing and Food Engineering

College of Agricultural Engineering & Technology

Junagadh Agricultural University

Junagadh-362001